

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૮/૨૦૧૬ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૪૬/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૯ કેસ કરી, ૨૨ વ્યક્તિઓને ઝડપી ૬૩ લીટર દેશી દારૂ, ૦૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ૪૦ ક્વોર્ટર ઈંગ્લીશ દારૂ અને ૧૧ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૦૬ કેસ કરી ૩૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૮,૩૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૪૭/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૫ વ્યક્તિઓની તેમજ પ્રોહી.૯૩ મુજબ ૦૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

અપહરણની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૪૪૮/૧૬

ઓઢવ : ઓમપ્રકાશ લક્ષ્મણભાઈ ગુપ્તા (રહે,અમરતભાઈની ચાલી, ભગવતીનગર સિંગરવા ઓઢવ) એ તા.૭/૮/૧૬ નારોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૫/૮/૧૬ સાંજના ૬/૦૦ વાગ્યાનાં સુમારે ઘર નજીકથી પોતાની સાડા ત્રણ વર્ષ પુત્રી પિન્કી ને કોઈ અજાણી વ્યક્તિ અપહરણ કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.એન.ચૌધરી ચલાવે છે.

સોનાનો દોરો ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૧૪૪૯/૧૬

મણીનગર : રીટાબહેન સુરેશભાઈ પટેલ (ઉ.વ.૪૫)(રહે.જવાહર ફ્લેટ, રમુજી હોલની બાજુમાં, જવાહરચોક, મણીનગર) તા.૭/૮/૧૬ ના કલાક ૮/૩૦ વાગ્યાના સુમારે ઘર નજીક થી ચાલતાં પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષ આશરનાં) રીટાબહેનનાં ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ રીટાબહેન પટેલે મણીનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એન. તેજોજ ચલાવે છે.

કાઠમબ્રાન્ય : જયદિપભાઈ તપનકુમારસેન ગુપ્તા (ઉ.વ.૨૮)(રહે.નાનો બારોટવાસ, પરબડી અને થલતેજ પોસ્ટ ઓફિસ પાસે, થલતેજ) એ તા.૭/૮/૧૬ નારોજ કાઠમબ્રાન્ય ખાતે ફરીયાદ નોંધાવી છે કે ફેબ્રુઆરી/૨૦૧૫ થી આજ દિન સુધીનાં સમયગાળા દરમ્યાન મોબાઈલ ફોન તથા ઈન્ટરનેટનાં માધ્યમથી આરોપી (૧) careejit.com નામની અમદાવાદની એજન્સી (૨) મો.નં.૯૧૦૪૧૭૦૬૨૬ - ૯૮૯૧૮૫૪૯૫૨ - ૮૭૩૫૮૩૭૪૨૬ - ૭૬૨૨૯૯૨૪૧૫ - ૯૧૦૪૧૭૦૬૧૧ તથા ૯૧૦૪૧૭૦૬૭૪ ના ધારકો (૩) બેન્ક ઓફ બરોડા, મણીનગર શાખામાં ખાતા નં.૦૩૩૨૦૧૦૦૦૨૦૮૦૬ નો ધારક પ્રદિપ એસ. જયસ્વાલ (૪) એસ.બી.આઈ. બેંક ખાતા નંબર ૨૦૧૦૪૮૭૮૯૯૯ ના ધારક પ્રદિપગીરી એસ. ગોસ્વામી અને તેમના મળતીયા ઇસમોએ ભેગામળી જયદિપભાઈના મિત્રને ફોન કરી નોકરી આપવાની લાલચ આપી નોકરી આપવાના જુદા જુદા ખર્ચ પેટે નાણાં મેળવી કુલ રૂપિયા ૨,૯૪,૧૧૯/- તેમજ નાણાં પરત મેળવવા માટેનો પણ ચાર્જ મેળવી નાણાં કે નોકરી નહીં આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી વી.કે.ખાંટ, કાઠમ બ્રાન્ય નાઓ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.